

Date: 28/05/2025

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400001

Scrip ID/Code/ISIN : BHATIA / 540956 / INE341Z01025

Subject : Intimation of Newspaper Advertisement of Extract of Standalone Audited Financial Results for the quarter and year ended 31-03-2025

Reference No. : Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Standalone Audited Financial Result for the quarter and year ended on 31st March, 2025 published in Newspapers on 28th May, 2025.

1. English Daily: "Free Press" dated 28th May, 2025.
2. Regional Language Daily: "Lokmitra" dated 28th May, 2025.

You are requested to kindly take the same on record.

Thanking you
Yours Faithfully,

For **Bhatia Communications & Retail (India) Limited**

Sanjeev Harbanslal Bhatia
Managing Director
DIN: 02063671

Place: Surat

Encl: Copy of Newspapers

Breast disease

Breast cancer today has become , a dreaded disease and has got deadlier for the modern woman who is becoming vulnerable to the illness. Breast cancer is the second most common cancer in Indian women. The incidence is more in urban than rural women. No doubt, we have seen a considerable change in the level of awareness among women in semi urban and urban areas. The rise is particularly affecting younger women between 30 and 40 years. The fault, to a certain extent, lies with the doctors too who do not encourage screening. Many of us have a misconception that visiting a doctor is required only if we have symptoms that

do not go away. It is important to understand that screening is for healthy women without any symptoms. Every woman after 40 should go for a mammogram test. Fathers, brothers and husbands should speak to their daughters, sisters and wives and make them understand the importance of regular breast and cervical cancer screening. Most girls work, have late marriages and then have children even later. All these factors work at increasing the chances of breast cancer," Stress and obesity are other factors that can increase the chances of having breast cancer. To prevent a disease, we need to spread awareness to mitigate the

risk factors that may lead to breast disease and breast cancer. In India, scientists are incredibly good at improving technology while simultaneously making it cost-effective. Irrespective of one's education, nutritional and socio-economic status, everyone faces a risk of developing cancer. This is called the population risk of developing cancer. A timely initiative with the right degree of gravity for raising awareness about breast cancer among the folks. To be frank, most people do have only a vague idea about breast cancer and the intensity of the malady. Cancer has always been considered a disease of

the aged. Though that is true to a certain extent, the age at which women develop breast cancer has undergone a change in the last two decades. An increasing number of breast cancers are detected in the 25-40 years age group. The mere presence of risk factors is not synonymous with the occurrence of breast cancer nor can all risk factors for breast cancer be mitigated or modified. Women must be familiar with structure of their breasts and do regular examinations. According to doctors, with changing times and a faster lifestyle, younger women are becoming more susceptible to the disease.

LESJA INDUSTRIES LIMITED


CIN: L27100GJ1992PLC018607

Registered Office. 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Road, Ahmedabad- 380 006, Gujarat, India.

AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2025

The Board of Directors of the Company in their meeting held on Tuesday, May 27, 2025, have approved and taken on record the statement of Audited Financial Results for the quarter and year ended on March 31, 2025 along with along with Audit report thereon in terms of Regulation 33 of SEBI (LODR) Regulations, 2015.

The aforesaid Audited Financial Results for the quarter and year ended on March 31, 2025 along with Audit report thereon are available on the website of BSE Limited at www.bseindia.com and on the website of company at www.lesha.in and can also be accessed by scanning below Quick response (QR) Code:



For Lesha Industries Limited
SD/-
Leena Ashok Shah
Managing Director
DIN: 02629934

Date : 27/05/2025

Place: Ahmedabad

BHATIA'S

The mobile one stop shop

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED

CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002

Website: www.bhatiamobile.com, mail: csbhatia@bhatiamobile.com, Ph: 9727714477



For Bhatia Communications & Retail (India) Limited
Sd/-
Sanjeev Harbanslal Bhatia
Managing Director
DIN: 02063671

Date: 27-05-2025

Place: Surat

The Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com/financial-report/

The financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 26th May, 2025.

PUROHIT CONSTRUCTION LIMITED

CIN : L45200GJ1991PLC015878

REGD.OFFICE:401,PUROHIT HOUSE,OPP:STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009

Telephone Number- 079-26426486, Emai Id: cs@purohitconstruction.com

Website:www.purohitconstruction.com

Statement of Standalone Audited Financial Results for the Quarter & Year Ended 31st March 2025

(Rs. in Lakh except EPS)

Sl. No.	Particulars	Three Months ended			Year Ended	
		31/03/2025 (Audited)	31/12/2024 (Unaudited)	31/03/2024 (Audited)	31/03/2025 (Audited)	31/03/2024 (Audited)
1.	Total Income from Operations	12.00	0.00	0.00	12.03	0.05
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	1.56	-10.33	-9.36	-26.61	-43.98
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	1.56	-10.33	-9.36	-26.61	-43.98
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	1.92	-10.52	-9.05	-25.21	-46.24
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1.60	-10.52	-9.33	-25.53	-46.52
6.	Equity Share Capital (Equity Shares of Rs.10/- Each)	440.56	440.56	440.56	440.56	440.56
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.00	0.00	0.00	0.00	0.00
8	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
	1. Basic:	0.04	-0.24	-0.21	-0.57	-1.05
	2. Diluted:	0.04	-0.24	-0.21	-0.57	-1.05

Notes :
1 The Above Financial Results have been reviewed by the Audit committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 27.05.2025
2 The above result for the quarter and year ended on 31.03.2025 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
3 The financial results for the quarter and year ended 31st March, 2025 have been audited by the statutory auditors of the Company. The Statutory Auditor expressed an unmodified opinion.
4 "During the quarter ended March 31, 2025, the Company received an order from the Goods and Services Tax (GST) Department for the financial year 2017-18, raising a demand of 74.16 crore, comprising 72.08 crore towards disallowance of input tax credit and 72.08 crore towards interest and penalty.""The Company has filed an appeal before the Commissioner (Appeals) and, based on internal evaluation and legal advice, believes that it has a strong case on merits and expects a favourable outcome. Accordingly, no provision has been made in the financial results. The said amount has been disclosed as a contingent liability."
5 The above financial results are available on the Company's website www.purohitconstruction.com and also on the website of BSE (www.bseindia.com)

For and on behalf of the Board of Directors

NARENDRA M. PUROHIT

(Chairman & Managing Director)

DIN:00755195

Place : Ahmedabad

Date : 27-05-2025

Sohail raped her for a year and a half, the victim's pain

Vadodara, Soheli Pathan, a resident of Ajwa Road in Vadodara city, lured a 17-year-old girl into a love trap and kept her at his house for one and a half years and raped her. Along with this, he forced the girl to convert to Islam. Fed up with Soheli's cruelty and torture, the girl finally filed a rape complaint against Soheli Pathan at the Kapurai police station on May 19, 2025. The victim was 17 years old at the time of the first rape, today (May 23) she is 19 years old, however, since she was a minor at that time, a crime has been registered under the

POCSO Act.

In a conversation with Divya Bhaskar, the victim shared her pain and said that if I left the house, he would threaten to break my hands and legs. He would get me drunk, tie me up, beat me and force me to drink alcohol. He would also give me cigarette butts. He would also coerce me. He would also threaten to kill my family. I just want to tell everyone that do not trust this person. 'I met Sohail while waiting for a rickshaw' Rape victim Namrata (name changed) told Divya Bhaskar that I met Sohail Nazim Khan Pathan

for the first time two years ago near Kamalanagar Lake. At that time, I was 17 years old. At that time, I was standing waiting for a rickshaw, at that time he came with a rickshaw and asked me where I wanted to go? So I said that I wanted to go to Mandvi. After that, I was sitting in the rickshaw and I did not have any spare money, so he told me that you give me your contact number, otherwise you take my contact number, then you give me the money. I will also drop

you at your house. 'After two or three months he started his sexual misconduct' He dropped me off at home and left. I gave him my mobile number. Then one day he suddenly sent me a message. Then I replied to you and we were talking in a friendly manner. We met once or twice and then we got into a love relationship. After that he took me to his house. Initially he treated me very well, but after two or three months he started his sexual misconduct.

Morbi businessman duped of over ₹1.5 crore in cryptocurrency investment scam

Ahmedabad, A complaint has been filed with the Morbi Cyber ??Crime Police Station for allegedly cheating a businessman from Morbi of over ₹1.5 crore by contacting him through WhatsApp, promising him to invest in cryptocurrency and earn money, and then not returning the money he invested. A businessman named Naimish Kanaiyalal Pandit (39), residing in Pramukh Heights in Kayaji Plot, Morbi, has filed a police complaint against two different WhatsApp mobile holders, seven bank account holders, and the accused who ought to be revealed during the investigation. The complaint states that the accused formed a criminal conspiracy and communicated through WhatsApp.

made the businessman invest in USDT cryptocurrency online, and gained his trust by communicating through WhatsApp with the tempting lure of earning money. Later, a total of ₹1,51,02,500 was invested from the complainant in multiple instalments. The invested money has not been returned to date and a complaint has been filed alleging fraud. Morbi Cyber ??Crime Police has registered a complaint and have initiated a probe.

WESTERN RAILWAY

AHMEDABAD DIVISION

ELECTRIC WORK

(1) Tender Number: M-ELS-VTA-25-26-CARBODY dated 26.05.2025 (2) Name of Work: Dismantling, Assembling and Repairing of Electric Locomotive Car body Filter at Electric Loco Shed Vatva for 2 years. (3) Estimated Cost of Work: ₹ 32,37,920.00/- (4) Cost of Tender Document: Nil (5) Earnest Money Deposit: ₹ 64,800/- (6) Period of Completion: 24 Months (7) Last date of submission of Tender: 26-06-2025 at 14:00 Hrs. (8) Website Particulars: www.ireps.gov.in (9) Tender inviting authority and its complete address: Senior Divisional Mechanical Engineer, Electric Loco Shed Vatva, Office of Sr. DME/ELS/VTA, Electric Loco Shed, Vatva, Western Railway, Ahmedabad, Gujarat-382 445

ADJ-051

Follow us on : [X.com/WesternRly](https://x.com/WesternRly)

PUBLIC NOTICE



Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 400604

The following borrower(s) has/have defaulted in the repayment of principal and interest towards the Loan facility(ies) availed from ICICI Bank. The Loan(s) has/have been classified as Non-Performing Asset(s) (NPA). A Notice was issued to them under Section 13(2) of the Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, at their last known addresses. However, it has not been served and are therefore being notified by way of this Public Notice.

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ (Loan Account Number) & Address	Description of Secured Asset to be enforced	Date of Notice sent/ Outstanding as on Date of Notice	NPA Date
1.	Pawan Kumar/ Hema A/c No. LBROH00005602858 Mkan No 186/4, Guradwara Tulmba Chok, Rohtak, Haryana Mehmed- 124112	Vacant Plot No. 1103, Old No. 661, Custodian No.186/2-B-VII, Uniq Id No.32C61U55, Situated at Ward No.3, Present Ward No.4, Inside Municipal Limits Mahem, Tehsil- Mehamed, District-Rohtak, Haryana- 124001	07/05/2025 Rs. 7,92,051.9/-	06-01-2025

These steps are being taken for substituted service of Notice. The above borrower/s and/or guarantor/s (as applicable) is/are advised to make the outstanding payment within 60 days from the date of publishing this Notice. Else, further steps will be taken as per the provisions of the Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.
Date: May 28, 2025, Place: Ahmedabad

Sincerely Authorised Officer,
For ICICI Bank Ltd.

Truhome

FINANCE

TRUHOME FINANCE LIMITED

(Formerly Shriram Housing Finance Ltd.)

Head Office: Level -3, Wockhardt Towers, East Wing C-2, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051; Tel: 1800 102 4345 ; Website: <http://www.truhomefinance.in>

Reg.Off.: Srinivasa Tower, 1st Floor, Door No.5, Old No.11, 2nd Lane, Cenatoph Road, Alwarpet, Teynampet, Chennai-600018

APPENDIX-IV-A [SEE PROVISION TO RULE 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described immovable properties mortgaged/ charged to Truhome Finance Limited (formerly Shriram Housing Finance Limited), the Physical Possession of which have been taken by the Authorized Officer of Truhome Finance Limited, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis for recovery of the balance due to Truhome Finance Limited from the Borrowers And Guarantors, as mentioned in the table.

Details of Borrowers and Guarantors, amount due, Short Description of the immovable property, reserve price and earnest money deposit and date of Inspection are also given as:

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagers	Amount of Recovery and date of Demand Notice	Reserve Price (Rs.) & Bid Increment	Date & Time of Auction	Contact Person Details – (AO and Disposal team)
1. SANTOSH KUMAR And 2. Naina kumari Shantosh Kumar All Having address at :-Flat No.A-213, Hari Krishna Residency, Bansri Park, Bagumara,Palsana,Surat-394305. Also at:-SK Logistics, Flat No.A-213, Hari Krishna Residency, Bansri Park,Bagumara,Palsana,Surat-394305. Also at:-Flat No.208,2nd Floor ,Building No.B,Hari Krishna Residency, Bansri Park Society,Opp.Sahiba Mill,Near Jolva Patiya,Bagumara,Kadodar,Surat,Gujarat-394305 LAN:- SHLHSRAT0001432	Demand Notice Date: 13.04.2024 Rs.6,84,231/- (Rupees Six Lakh Eighty Four Thousand Two Hundred Thirty One Only) as on 06-04-2024 under reference of Loan Account No. SHLHSRAT0001432with further interest at the contractual rate, within 60 days from the date of receipt of the said notice	Rs.2,00,000/-(Rupees Two Lakh Only) Bid Increment: Rs. 10,000/- and in such multiples. Earnest Money Deposit (EMD) (Rs.) Rs.20,000/- (Rupees Twenty Thousand Only) Last date for submission of EMD : 16th JUNE, 2025, Time 10.00 a.m. to 05.00 p.m.	17 June-2025 Time: 11 AM to 1 PM.	Ashfaq Patka 9819415477 Dharmendrasinh Chauhan- 76007 62777 Date of Inspection – 06.06.2025, Time.11 AM to 1 PM

Description of Property

All right title and interest in Flat No.B/208, on 2nd Floor adm.580 sq.ft.Super Built-Up area & 319 sq.ft.s.i.e.29.65 sq.mtrs.Built up area together with undivided proportionate share in underneath land in Building No.B of "Harikrushna Residency"constructe on Plot No.13 to 17 in "Bansri Park", Situate on the land bearing R.S.No.71 Block No.91 of Village Bagumara,Taluka Palsana,Dist.Surat. Boundaries of the property:- East- Entry & Passage, West - Society's Wall, North :- Flat No.207, South :- Flat No.209

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagers	Amount of Recovery and date of Demand Notice	Reserve Price (Rs.) & Bid Increment	Date & Time of Auction	Contact Person Details – (AO and Disposal team)
1. Naim Uddin And 2. Mariya khatoon All Having address at :-A 229 Mangaldeep Society,Near Meera Nagar, Ankleshwar, Bharuch, Gujarat-393001. Also at:-25 Om Residency,Gadkol Patiya, Ankleshwar, Gadkol, Bharuch,Gujarat-393010 Also at:- @ Mansi Roadlines, F-2, Gurukrupa Complex Village-Kansia, Near Rajwadi Hotel, Ankleshwar,Gujarat-393001 Also at:- Plot No.A-86,Zam Zam Park, Nr.Adivasi Faliyu, Kapodra, Ankleshwar,Gujarat-393001 Also At:-Village –Kharwai, Post-Sarai Raja, Khanwanie, Pratapggarh, Uttar Pradesh-230404 LAN:- SHLHBRUH0000387	Demand Notice Date: 12.10.2024 Rs. 18,80,053/- (Rupees Eighteen Lakh Eighty Thousand Fifty Three Only) as on 9/10/2024 under reference of Loan Account No. SHLHBRUH0000387 with further interest at the contractual rate, within 60 days from the date of receipt of the said notice	Rs.13,50,000/-(Rupees Thirteen Lakh Fifty Thousand) Bid Increment: Rs. 10,000/- and in such multiples. Earnest Money Deposit (EMD) (Rs.) Rs. 1,35,000/- (Rupees One Lakh Thirty Five Thousand Only) Last date for submission of EMD : 30th JUNE , 2025, Time 10.00 a.m. to 05.00 p.m.	01 July-2025 Time: 11 AM to 1 PM.	Ashfaq Patka 9819415477 Dharmendrasinh Chauhan- 76007 62777 Date of Inspection – 20.06.2025, Time.11 AM to 1 PM

Description of Property

All that piece and parcel of non-agricultural plot of land in Mauje Kapodra, Bharuch lying being land bearing Old R.S. no. 55, & New R.S.no.232, Known as "ZAM ZAM PARK" Paikki Plot no. A-86 Plot area admeasuring 90.00 Sq. Mtrs., i.e.968.50 Sq.Fts.at Registration and Sub District Ankleshwar, District Bharuch. Boundaries of the property:-East :-By Society internal Road , West :-By Plot No. A-78 , North:-By Plot No.A-87 , South:- By Plot No.A-85

1) For detailed terms and conditions of the sale, please refer the website of Truhome Finance Limited (Formerly Shriram Housing Finance Limited) website.

2) The intending bidders have to submit their EMD amount to be deposited by way of RTGS/NEFT to the account details mentioned herein below: BANK NAME: AXIS BANK LIMITED BRANCH: BANDRA KURLA COMPLEX, MUMBAI BANK ACCOUNT NO. Current Account No. 911020045677633 IFSC CODE: UTIB0000230.

Place : Surat

Date : 28-05-2025

Sd/-

Authorised Officer- Truhome Finance Limited

(Formerly Shriram Housing Finance Limited)

વડોદરા કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા ઠેર-ઠેર ચેકિંગ : ૩૧૦ લીટર પાણીપુરીનું પાણી સહિત અખાદ્ય પદાર્થોનો નાશ

વડોદરા, ઉનાળાની ઋતુને અનુલક્ષીને શહેરની જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાનમાં રાખી પાલિકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક માસથી ખાણીપીણીની લારીઓ, દુકાનો, કુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ,

કેરીના રસના તંબુઓ, શેરડીના રસના કોલાના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની ઋતુને અનુલક્ષીને ય્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સૂચનાં મુજબ ડેઝીનેટેડ ઓફિસર અને અધિક

આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા બે ટીમો બનાવી આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. ખોરાક શાખાનાં કુડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-

વાવાઝોડાંની ભીતિને લીધે માંગરોળ બંદરે ૨,૦૦૦ બોટ લંગારી દેવાઈ


જૂનાગઢ, આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહીને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લાની તમામ બોટને બંદર ખાતે પરત બોલાવવા માટેના થયેલા આદેશ મુજબ માંગરોળ બંદર ખાતે બે હજાર બોટ પરત આવી ગઈ છે. ચોમાસા પુર્વે જ વાવાઝોડાની આગાહીના કારણે માછીમારીની સિઝન આ વખતે વહેલાસર પૂર્ણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસંધાને સમગ્ર રાજ્યમાં તંત્રને સાબરું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક આયોજન કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં દરિયામાં ફિશિંગ માટે ગોળા તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી, તે અનુસંધાને માંગરોળ બંદર પર નાત રાતથી જ બોટ પરત આવવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે સાંજ સુધીમાં બે હજાર જેટલી બોટ બંદર પર લંગારી દેવામાં આવી છે. માછીમાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનાથી જ માછીમારીના ધંધામાં ખૂબ જ મંદી ચાલતી હોવાથી મોટાભાગની બોટ બંદર પર જ હતી, ફિશિંગ માટે ગઈ ન હતી. અમુક બોટ ફિશિંગ માટે ગઈ હતી તે પરત આવી ગઈ છે. હવે માત્ર બે બોટ છે તે લાંબા અંતર પર ફિશિંગ માટે ગઈ છે તેને પણ તાત્કાલિક પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવતા છે. આજે રાતે અથવા આવતીકાલે સવાર સુધીમાં બંદર પર પરત આવી જશે. માંગરોળ બંદર પર જે બોટ આવી ગઈ છે તેને દરિયા માંથી બહાર કાઢવાની પણ પૂરજોશમાં સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટાભાગની બોટને નુક્સાન ન થાય તે માટે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવી છે. હાલ જે બોટ કાંઠા પર છે તેને સલામત રીતે નુક્સાન ન થાય તેમ રાખવામાં આવી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું.

દિવ્યાંગ તરણવીર ગરિમા વ્યાસની સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ખેલ મહાર્કુભમાં ગરિમા વ્યાસે બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી પ્રસન્નતા વ્યક્ત કરી

વડોદરા સ્પેશિયલ ખેલ મહાર્કુભની તૃતીય આવૃત્તિની તરણ સ્પર્ધામાં બે ગોલ્ડ મેળવનારી વડોદરાની દિવ્યાંગ ખેલાડી શ્રી ગરિમા વ્યાસની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ પાંદવેલા શુભેચ્છાપત્રમાં જણાવ્યાં છે કે, વડાપ્રધાનશ્રીએ પ્રયોજેલો 'દિવ્યાંગ' શબ્દ આપ જૈવા પ્રતિભા સંપન્ન, અડગ મનોબળ ધરાવતા પરિશ્રમી વ્યક્તિઓ દ્વારા સાર્થક સિદ્ધ થતો જોઈને આનંદ થાય છે. તંદુરસ્ત વ્યક્તિઓને માટે પણ કઠિન એવી સફળતા પ્રાપ્ત કરી ગરિમાબેને અલગ ચીલો ચામડું છે.

મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિનો પરચમ લહેરાવી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ ગરિમાબેન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૦થી પ્રતિવર્ષ "ખેલ મહાર્કુભ"ના આયોજન



કરાવ્યાં હતાં. વર્તમાન સરકાર પણ આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે ચલાવી રહી છે. જેના પરિણામે યુવાનોને પોતાના રમતગમતનું કોશલ્ય દર્શાવાના ઉત્તમ અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે. યુવાનોની રમતગમતમાં રુચિ અને સજજતામાં સારા પરિણામે વધારો વધારો થઈ રહ્યો છે. પાવાગઢના પર્વતોમાં ટ્રેકિંગ દરમિયાન થયેલ અણધાર્યા

અકસ્માતમાં શરીરના કમરથી નીચેના ભાગમાં સંવેદનશૂન્યતા આવી ગઈ. આવા મોટા અવરોધને પણ આત્મવિશ્વાસ અને મહેનતથી પાર કરીને ગરિમાબેન સ્વિમર બન્યા અને સ્વિમિંગના ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહ્યાં એ બાબત બિરદાવવા લાયક રહ્યાં.

વિકટ પરિસ્થિતિ સામે બાથ ભરીને આપે પ્રાપ્ત કરેલ સફળતા અનેક રમતવીરો માટે પ્રેરક છે.

DSWRO ઓફિસ વડોદરા ખાતે વીર નારીઓ અને તેમના બાળકોને સશક્ત બનાવવા માટે સ્નેહ મિલનનું આયોજન

વડોદરા, આજરોજ ૨૩ મે ૨૦૨૫ ના રોજ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય, વડોદરા ખાતે, લેફ્ટનન્ટર્નલ (ડૉ.) કમલપ્રીત સાગી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારીના નેજા હેઠળ સૈનિકો/ભૂતપૂર્વ સૈનિકોના વીર નારીઓ, વિધવાઓ અને બાળકો માટે સ્નેહ મિલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીર નારીઓ અને વિધવાઓ, તેમના બાળકો અને વિવિધ સફળ મહિલા ઉદ્યોગસાહસિકો અને NGO ને એકસાથે બાળવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય તેમના માટે નાણાકીય સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાની કુશળતાઓ હતા. વીર નારીઓ, સફળ મહિલા ઉદ્યોગસાહસિકો પણ

સામેલ હતા જેમણે તેમની યાત્રા, પડકારો અને સફળતાની વાર્તાઓ શેર કરી. આ કાર્યક્રમમાં ઓન્ટરેક્ટિવ વર્કશોપ, વ્યવહાર કોશલ્ય-વિકાસ મોડ્યુલ અને ટેલરિંગ અને ફેશન ડિઝાઇન, સેનિટરી નેપકિન ઉત્પાદન, સુંદરતા અને સુખાકારી સેવાઓ, માટીના હસ્તકલા અને માટીકામ, અને આયુર્વેદિક અને હર્બલ ઉપાદાન શાસત્રો જેવા આશાસ્પદ નાના પાયે વ્યવસાય મોડેલોના જીવંત પ્રદર્શનો હતા. આ કાર્યક્રમે માત્ર સહભાગીઓની શક્તિ અને હિંમતનું સન્માન કર્યું નહીં પરંતુ તેમને સ્વતંત્ર રીતે કમાણી શરૂ કરવામાં મદદ કરવા માટે ઉદ્યોગી કુશળતા અને જ્ઞાન પણ આપ્યું.



વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં ઘરેલુ કચરો ફેંકવાના કન્ટેનરો ઉઠાવી લેવાતા મુશ્કેલી



વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં લોકોના ઘરનો કચરો ફેંકવા માટે કોર્પોરેશન દ્વારા જે કન્ટેનર મૂકવામાં આવેલા તે ઉઠાવી લેવામાં આવતા લોકો હવે કચરો બહાર રોડ પર નાખે છે, જેના કારણે આખો દિવસ કચરો રોડ પર પડ્યો રહે છે અને ગંદકી ફેલાવે છે. એક બાજુ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને બીજી બાજુ કચરાના કન્ટેનર ઉઠાવી લે છે તેના કારણે ગંદકી વધુ ફેલાતી રહે છે.

વિશ્વામિત્રી બચાવે સમિતિ દ્વારા કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે કે શહેરમાં ખાસ કરીને રહેણાંક સ્થળોએ સવારે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનું વાહન કચરો લઈ ગયા બાદ દિવસ દરમિયાન ઘરોમાં ભેગો થતો કચરો નાખવા માટે ચોક્કસ સ્થળો ઉપર કન્ટેનરો મુકેલા હતા. કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા પાસે બાગ રિમાન્ડ હોમ નજીક પસાર થતી વરસાદી કુદરતી બહુચરાજી કાંસના કિનારે ખુલ્લા પ્લોટમાં દિવસ દરમિયાન ઘરેલું કચરો કોઈને પાછા નાખી શકે તેવું કન્ટેનર મુકેલું હતું. આ સ્થળ પાસે રહેતા કોઈએ કન્ટેનર ઉઠાવી લેવાડાવ્યું હતું. બાદમાં અહીં દબાજ કરતા તે તોડવા કોર્પોરેશનની દબાજ શાખાની ટીમ સાથે પાલિકાના ચુટાચેલા પદાધિકારીઓની હાજરીમાં તેમની ઉપર ગેસનો છુટો સિલિન્ડર ફેંક્યો હતો. ત્યારથી ઉઠાવી લીધેલ કન્ટેનર પરત મુકેલું નથી. જેથી રહેવાસીઓ ઘરેલું કચરો રોડ ઉપર નાખી જાય છે. આયકન્યાથી સ્નાનાધર જતા એક કોર્નર પર કચરો નાખવાનું કન્ટેનર હતું ,તે પણ ઘણા સમયથી ઉઠાવી લીધેલું છે. ભુતતીઆપા મેદાન પાસે પણ કચરો નાખવાનું કન્ટેનર હતું. જે ઉઠાવી લીધેલું છે. સવારે ડોર ટુ ડોર કચરા ગાડી આવી ગયા બાદ ભેગો થતો કચરો ક્યા નાખવા જવું તે મોટી સમસ્યા છે. જેથી ફરી પાછા કન્ટેનરો મૂકવા રજૂઆત કરી હતી.

HCP Plastene Bulkpack Limited

CIN : L25200GJ1984PLC050560
H. B. Jirawala House, 13, Navbharat Society, Usmanpura, Ahmedabad, Gujarat-380013
Website : www.hpbl.in • Email : info@hpbl.in
Contact : +91 79 27561000

The meeting of the Company was held on 26th May, 2025 approved the Audited Standalone Financial Results of the Company for the quarter and Financial year ended on 31st March, 2025.

The detailed format of Quarterly / Yearly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of quarterly / yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.hpbl.in)



Date: 27-05-2025
Place: Ahmedabad

For HCP Plastene Bulkpack Limited
Sd/-
PRAKASH HIRALAL PAREKH
Managing Director
DIN: 00158264

LESHA INDUSTRIES LIMITED

CIN: L27100GJ1992PLC018607

Registered Office. 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Road, Ahmedabad- 380 006, Gujarat, India.

AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2025

The Board of Directors of the Company in their meeting held on Tuesday, May 27, 2025, have approved and taken on record the statement of Audited Financial Results for the quarter and year ended on March 31, 2025 along with along with Audit report thereon in terms of Regulation 33 of SEBI (LODR) Regulations, 2015.

The aforesaid Audited Financial Results for the quarter and year ended on March 31, 2025 along with Audit report thereon are available on the website of BSE Limited at www.bseindia.com and on the website of company at www.lesha.in and can also be accessed by scanning below Quick response (QR) Code:

For Lesha Industries Limited
SD/-
Leena Ashok Shah
Managing Director
DIN: 02629934

BHATIA'S Bhatia Communications & Retail (India) Limited

The mobile one stop shop

CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Website: www.bhatiamobile.com, mail: csbhatia@bhatiamobile.com, Ph: 9727714477

The Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com/financial-report/

The financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 26th May, 2025.

For Bhatia Communications & Retail (India) Limited
Sd/-
Sanjeev Harbanslal Bhatia
Managing Director
DIN: 02063671

Date: 27-05-2025
Place: Surat

ભૌતિક કબજા નોટીસ			
ક્રમ	દેવાદારોનું નામ/સહ-દેવાદારોનું નામ/ લોન એકાઉન્ટ નંબર	મિલકતોની વિગતો / કબજાની તારીખ	દિમાન્ડ નોટીસની તારીખ / દિમાન્ડ નોટીસની રકમ (રૂ.)
૧.	ચૌધાણ પાડચેભાઈ નિલેશકુમાર (દેવાદાર), નિલેશકુમાર એમ. ચૌધાણ (સહ-દેવાદાર), LHBRO00001338476.	સી/૧૦ મંગલ મુર્તિ એપાર્ટમેન્ટ નોનિનો પેટરી સામે સુસેન સર્કલ પાસે મહરપુરા વોડેરા આર.એસ. નં. ૧૬૧/૧ સીએસ નં. ૧૮૦૭ વડોદરા- ૩૮૦૦૧૪, ચતુર્સીમા- ઉત્તર: ફ્લેટ નં. સી.૮, દક્ષિણ: આંતરિક માર્ગ, પૂર્વ: ખુલ્લી જગ્યા, પશ્ચિમ: ખુલ્લી જગ્યા/ કબજાની તારીખ- ૨૩-મે-૨૫	27-04-2022 Rs. 29,11,123/-
૨.	ચૌધાણ પાડચેભાઈ નિલેશકુમાર (દેવાદાર), નિલેશકુમાર એમ. ચૌધાણ (સહ-દેવાદાર), LHBRO00001338566.	સી/૧૦ મંગલ મુર્તિ એપાર્ટમેન્ટ નોનિનો પેટરી સામે સુસેન સર્કલ પાસે મહરપુરા વોડેરા આર.એસ. નં. ૧૬૧/૧ સીએસ નં. ૧૮૦૭ વડોદરા- ૩૮૦૦૧૪, ચતુર્સીમા- ઉત્તર: ફ્લેટ નં. સી.૮, દક્ષિણ: આંતરિક માર્ગ, પૂર્વ: ખુલ્લી જગ્યા, પશ્ચિમ: ખુલ્લી જગ્યા/ કબજાની તારીખ- ૨૩-મે-૨૫	27-04-2022 Rs. 1,50,657/-
૩.	સોલંકી અશોકકુમાર મંગળ ભાઈ (દેવાદાર), સોલંકી પશ્વિમભાઈ અશોકભાઈ (સહ-દેવાદાર), સોલંકી સાગર (સહ-દેવાદાર), LHBRO00001346851.	થુનિટ નં. સી/૪૦૪, આમ સાર્થ રેસીડેન્સી કમ્પ્લેક્સનગર તથાવ પાસે આજવા રોડ વડોદરા ખાતા નં. ૩૨૭૪ આર.એસ. નં. ૭૦ સીએસ નં. ૧૭૩ વડોદરા જુજરાત/ કબજાની તારીખ- ૨૪-મે-૨૫	23-05-2022 Rs. 77,349/-
૪.	સોલંકી અશોકકુમાર મંગળ ભાઈ (દેવાદાર), સોલંકી પશ્વિમભાઈ અશોકભાઈ (સહ-દેવાદાર), સોલંકી સાગર (સહ-દેવાદાર), LHBRO00001346850.	થુનિટ નં. સી/૪૦૪, આમ સાર્થ રેસીડેન્સી કમ્પ્લેક્સનગર તથાવ પાસે આજવા રોડ વડોદરા ખાતા નં. ૩૨૭૪ આર.એસ. નં. ૭૦ સીએસ નં. ૧૭૩ વડોદરા જુજરાત/ કબજાની તારીખ- ૨૪-મે-૨૫	23-05-2022 Rs. 12,94,689/-
૫.	ગોવેલ કેલાશ મગનભાઈ (દેવાદાર), મગન પ્રેમજી ગોવેલ (સહ-દેવાદાર), LHJGH00001505752.	કમનાથ સોસાયટી ભાલપરા રોડ ભાલપરા વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ આર.એસ. નં. ૩૦ પી ૩૧ પી જુનાગઢ જુજરાત- ૩૬૨૦૦૧ (સંદર્ભ લેન નં. LHJGH00001505752), ચતુર્સીમા- ઉત્તર: એડીજ પ્લોટ નં. ૨૬, દક્ષિણ: ૬ ૧૦ મીટર રોડ, પૂર્વ: ૧૦ મીટર રોડ, પશ્ચિમ: એડીજ પ્લોટ નં. ૩૪/કબજાની તારીખ- ૨૪-મે-૨૫	17-02-2024 Rs. 17,36,587/-
૬.	ગોવેલ કેલાશ મગનભાઈ (દેવાદાર), મગન પ્રેમજી ગોવેલ (સહ-દેવાદાર), LHJGH00001505753.	કમનાથ સોસાયટી ભાલપરા રોડ ભાલપરા વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ આર.એસ. નં. ૩૦ પી ૩૧ પી જુનાગઢ જુજરાત- ૩૬૨૦૦૧ (સંદર્ભ લેન નં. LHJGH00001505752), ચતુર્સીમા- ઉત્તર: એડીજ પ્લોટ નં. ૨૬, દક્ષિણ: ૬ ૧૦ મીટર રોડ, પૂર્વ: ૧૦ મીટર રોડ, પશ્ચિમ: એડીજ પ્લોટ નં. ૩૪/કબજાની તારીખ- ૨૪-મે-૨૫	17-02-2024 Rs. 74,921/-
૭.	ગમ ચંદ વિજય પ્રતાપ સિંહ (દેવાદાર), રોડા દેવી (સહ-દેવાદાર), LHPVTD0000151420.	ફ્લેટ નં. ૭૦૪, ગ્રાઉન્ડ ફ્લોર, દક્ષિણ પાર્ક-૨, ગોલ્ડપ્લમ પાસે, સર્વે નં. ૧૮૯/ રોડા દેવી (સહ-દેવાદાર), ૧૦, ચાણદેવ હોમ, તાલુકા, જિલ્લો વલસાડ, ૩૮૬૧૧૨, ચતુર્સીમા- ઉત્તર: ખુલ્લી જગ્યા, દક્ષિણ: પેલેજ અને પાર્કિંગ, પૂર્વ: ફ્લેટ નં. ૭૦/૦૫, પશ્ચિમ: ફ્લેટ નં. ૭૦/૦૫/ કબજાની તારીખ- ૨૪-મે-૨૫	17-10-2024 Rs. 19,05,760.76/-
૮.	પ્રકાશ ચંદ સેન (દેવાદાર), લલિતા સેન (સહ-દેવાદાર), LHPVTD00001533723.	ફ્લેટ નં. ૧૦૨, પહેલો માળ ભાલાજી વાટિકા છીરી ગ્રામ પંચાયત પાસે રણછોડ નગર છીરી ખાતે જિલ્લો વાપી- ૩૮૬૧૧૮, છીરી ૨૫૫ ૧૦૨ વાપી જુજરાત ૩૮૬૧૧૮, ચતુર્સીમા- ઉત્તર: ખુલ્લી જગ્યા, દક્ષિણ: પેલેજ અને ફ્લેટ નં. ૧૦૧, પૂર્વ: ફ્લેટ નં. ૧૦૩, પશ્ચિમ: ખુલ્લી જગ્યા/ કબજાની તારીખ- ૨૪-મે-૨૫	17-10-2024 Rs. 13,82,194.14/-
૯.	પ્રકાશ ચંદ સેન (દેવાદાર), લલિતા સેન (સહ-દેવાદાર), LHPVTD00001533780.	ફૂકાન નં ૦૧, ગ્રાઉન્ડ ફ્લોર, ભાલાજી વાટિકા, પ્લોટ નં ૫૧ પર ૫૩, છીરી ગ્રામ પંચાયત પાસે, રણછોડ નગર, છીરી વલસાડ ખાતે, વાપી- જુજરાત- ૩૮૬૧૧૮, ચતુર્સીમા- ઉત્તર: સોસાયટી રોડ, દક્ષિણ: અન્ય બિલ્ડિંગ, પૂર્વ: ખુલ્લો પ્લોટ, પશ્ચિમ: ફૂકાન નં. ૦૨/ કબજાની તારીખ- ૨૪-મે-૨૫	17-10-2024 Rs. 10,60,097.16/-
૧૦	સોલંકી જયજીકુમાર મણિલાલ (દેવાદાર), સોલંકી વસુમીબેન મણિલાલભાઈ (સહ-દેવાદાર), હરિજન મણિલાલ કપરાભાઈ (સહ-દેવાદાર), LHBRO00001349877.	એક સ્થાવર મિલકત, રહેણાંક ફ્લેટ નં. સીજી/૨ એડીએમએસ. ૪૩.૫૮ ચોરસ મીટર ટાવર-સી ના ગ્રાઉન્ડ ફ્લોર પર, 'કાસ રેસીડેન્સી' તરીકે ઓળખાતી સ્કીમમાં, ગામ- વડસર બેરિંગ આર. એસ. નં. ૭૪૬/૧, રજીસ્ટ્રેશન જિલ્લો અને પેટા જિલ્લો- વડોદરા- ૩૮૦૦૧૦ ખાતે આવેલી જમીન પર બંધવામાં આવી છે. ચતુર્સીમા- ઉત્તર: ફ્લેટ નં. સીજી/૩, દક્ષિણ: સામાન્ય વિસ્તાર, પૂર્વ: ફ્લેટ નં. સીજી-૧, પશ્ચિમ: સામાન્ય વિસ્તાર/ કબજાની તારીખ- ૨૫-મે-૨૫	23-12-2024 Rs. 11,98,258.74/-
૧૧	સોલંકી જયજીકુમાર મણિલાલ (દેવાદાર), સોલંકી વસુમીબેન મણિલાલભાઈ (સહ-દેવાદાર), હરિજન મણિલાલ કપરાભાઈ (સહ-દેવાદાર), LHBRO00001349878.	એક સ્થાવર મિલકત, રહેણાંક ફ્લેટ નં. સીજી/૨ એડીએમએસ. ૪૩.૫૮ ચોરસ મીટર ટાવર-સી ના ગ્રાઉન્ડ ફ્લોર પર, 'કાસ રેસીડેન્સી' તરીકે ઓળખાતી સ્કીમમાં, ગામ- વડસર બેરિંગ આર. એસ. નં. ૭૪૬/૧, રજીસ્ટ્રેશન જિલ્લો અને પેટા જિલ્લો- વડોદરા- ૩૮૦૦૧૦ ખાતે આવેલી જમીન પર બંધવામાં આવી છે. ચતુર્સીમા- ઉત્તર: ફ્લેટ નં. સીજી/૩, દક્ષિણ: સામાન્ય વિસ્તાર, પૂર્વ: ફ્લેટ નં. સીજી-૧, પશ્ચિમ: સામાન્ય વિસ્તાર/ કબજાની તારીખ- ૨૫-મે-૨૫	23-12-2024 Rs. 89,402.32/-
૧૨	સોલંકી જયજીકુમાર મણિલાલ (દેવાદાર), સોલંકી વસુમીબેન મણિલાલભાઈ (સહ-દેવાદાર), હરિજન મણિલાલ કપરાભાઈ (સહ-દેવાદાર), LHBRO00001350271.	એક સ્થાવર મિલકત, રહેણાંક ફ્લેટ નં. સીજી/૨ એડીએમએસ. ૪૩.૫૮ ચોરસ મીટર ટાવર-સી ના ગ્રાઉન્ડ ફ્લોર પર, 'કાસ રેસીડેન્સી' તરીકે ઓળખાતી સ્કીમમાં, ગામ- વડસર બેરિંગ આર. એસ. નં. ૭૪૬/૧, રજીસ્ટ્રેશન જિલ્લો અને પેટા જિલ્લો- વડોદરા- ૩૮૦૦૧૦ ખાતે આવેલી જમીન પર બંધવામાં આવી છે. ચતુર્સીમા- ઉત્તર: ફ્લેટ નં. સીજી/૩, દક્ષિણ: સામાન્ય વિસ્તાર, પૂર્વ: ફ્લેટ નં. સીજી-૧, પશ્ચિમ: સામાન્ય વિસ્તાર/ કબજાની તારીખ- ૨૫-મે-૨૫	23-12-2024 Rs. 4,96,898.92/-

ઉપરોક્ત દેવાદાર (ઓ)/ભાંધેપરી આપનારાઓને આથી રકમ ચૂકવવા માટે ૩૦ દિવસની નોટિસ આપવામાં આવે છે. એનકયા આ સૂચનાના પ્રકાશનની તારીખથી ૩૦ દિવસની સમિતિ પર ગૌરવ મૂકી ચુક્યા હોત (એનોસંમેન્ટ) નિયમો ૨૦૦૨ ના નિયમો ૮ અને ૯ હેઠળની જોગવાઈઓ સંબંધિત વિધેયો અવગણે.

તારીખ : મે ૨૮, ૨૦૨૫, સ્થળ : વડોદરા, જુનાગઢ, વલસાડ, વાપી

અધિકૃત અધિકારી, આઈસીઆઈસીઆઈ હોમ ફાઉન્ડાશન કંપની લિમિટેડ વલી